

GUJARAT TERCE LABORATORIES LIMITED

09th November, 2020

To,
Corporate Relations Department,
Bombay Stock Exchange Limited,
2nd Floor, P.J Towers,
Dalal Street,
Mumbai-400 001

Scrip Code: 524314

Subject: Publication of Extract of Unaudited Financial Results for the Quarter and half year ended on 30th September, 2020

Dear Sir/Madam,

With reference to the above subject, please find enclosed herewith the copy of published Extract of Unaudited Financial Results for the Quarter and half year ended on 30th September, 2020 in the Business Standard- English and Jay Hind Gujarati Edition, dated November 09, 2020.

Thanking You,

Yours faithfully,

For, Gujarat Terce Laboratories Limited

Ashka Solanki

Company Secretary & Compliance Officer

Encl: As above

CIN: L28112GJ1985PLC007753

Admn. Office: D/801 & 802, The First, Behind Keshavbaug Party Plot,

Near Shivalik High-street, Vastrapur, Ahmedabad-380015 Gujarat.(INDIA) Ph.: 079-48933701

E.mail : ho@gujaratterce.com • Web. : www.gujaratterce.com

CIN:L24100GJ1985PLC007753

quant Mutual Fund

quant

Registered Office: 6th Floor, Sea Breeze Building, A. M. Road, Prabhadevi, Mumbai - 400 025. Tel.: +91 22 6295 5000 E-mail: help.mf@quant.in Website: www.quantmutual.com

NOTICE CUM ADDENDUM NO. 20/2020

Revert to Normal Cut Off Timing for Specified Scheme(s)

We refer to our all previous notices on change in cut-off timings for schemes of quant Mutual Fund. Investors are requested to note that, it has been decided by SEBI to restore normal cut off timings for applicability of NAV for both subscription and redemption for all Mutual Fund schemes in accordance with various circulars and notification dated November 06, 2020 issued by SEBI in this regard. Accordingly, the cut-off timing for the scheme(s) of quant Mutual Fund with effect from November 09, 2020, will be as under: In case of subscription

- For quant Liquid Fund - 01:30 p.m.


- For all schemes (except quant Liquid Fund) - 03:00 p.m.

In case of Redemption/Switches

All other terms & conditions of SID and KIM of the aforesaid scheme(s) of the Fund will remain unchanged.

This addendum forms an integral part of the SID and KIM of the aforesaid scheme(s) of the Fund. Investors are requested to kindly take For quant Money Managers Limited Place : Mumbai

Date: 07.11.2020 **Authorised Signatory** MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS, READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.





Business Standard

Insight Out

To book your copy, call **022 4027 5432** or SMS reachbs to **57575** or email us at order@bsmail.in



www.business-standard.com



GUJARAT TERCE LABORATORIES LIMITED

Reg. Office:- 122/2, Ravi Estate, Bileshwarpura, Chhatral, Dist. Gandhinagar (Gujarat) Phone:- 079 - 48933706, CIN NO: L24100GJ985PLC007753 email: gtil.factory@gmail.com website:www.gujaratterce.in

Extract of Unaudited Financial Results for the Quarter and Half Year Ended on September 30, 2020									
[RS.IN LAKHS EXCEPT PER SHARE DETAI									
		Half ye	Year ended						
	Particulars	30.09.2020	30.09.2019	31.03.2020					
		(Unaudited)	(Unaudited)	(Audited)					
1	Income								
	a) Revenue from operations (Net)	1,217.84	1,808.50	3,754.39					
	b) Other income	15.48	1.52	28.61					
2	Net Profit / (Loss) for the period (before Tax,								
	Exceptional and/or Extraordinary items)	-45.92	47.73	43.59					
3	Net Profit / (Loss) for the period before Tax								
	(after Exceptional and/or Extraordinary items)	-45.92	47.73	43.59					
4	Net Profit / (Loss) for the period after Tax								
	(after Exceptional and/or Extraordinary items)	-45.92	47.73	27.61					
5	Total Comprehensive Income for the period								
	[Comprising Profit /(Loss) for the period (after tax)								
	and Other Comprehensive Income (after tax)]	-45.92	47.73	27.61					
6	Paid up Equity Share Capital	742.03	742.03	742.03					
7	Reserves (excluding Revaluation Reserve)	323.13	389.19	369.07					
8	Net worth	1,065.16	1,131.22	1,111.10					
9	Debt Equity Ratio	0.60:1	0.39:1	0.20:1					
10	Earnings Per Share (of Rs.10/-each)								
	(for continuing and discontinued operations)-								
	1. Basic:								

Notes:

2. Diluted:

[1] The Above unaudited results have been reviewed by Audit Committee and approved by the Board of Directors of the Company in their meeting held on 07.11.2020. The Statutory Auditors have carried out limited review of the financial results for the quarter and half year ended on 30th September, 2020

[2] The Above unaudited results have been prepared and presented as per Companies (Indian Accounting Standards) Rules 2015 as amended ("Ind AS") prescribed under section 133 of the Companies Act, 2013 and in terms of Regulations 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (the "Listing Regulations"), and amendments made thereunder.

[3] The above is an extract of the detailed format of Financial Results for the quarter ended on September 30, 2020 filed with the Stock exchanges as per SEBI (Listing Obligations and Disclosure Requirement) Regulations, 2015. The full format of Consolidated financial results are available on the website of BSE at www.bseindia.com and on company's website www.gujaratterce.in

By and order of the Board of Director For Gujarat Terce Laboratories Limited Sd/-

0.37

Place: Ahmedabad Date: 07.11.2020

Aalap Prajapati **Whole Time Director** DIN: 08088327



Surat Main Branch

POSSESSION NOTICE (For immovable property)

the undersigned being the Authorised Officer of The South Indian Bank Ltd. under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13 (12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued demand notice dated 07.04.2018 u/s 13(2) of the Act and also issued its Corrigendum dated 16.05.2018 calling upon the borrower Mr. Amit Shantilal Chopra, S/o Mr. Shantial Chopra, Proprietor of M/s. Laxmi Jewellers, Shop No.17,18 & 19, Affiel Tower, Lambe Hanuman Road, Varachha, Surat, Gujarat- 395 006 and also at L-501 & 502, Neelkanth Residency, Canal Road, Palanpur, Adajan, Surat, Gujarat- 395 009 and at 265, 1st Polo, Paota, Nr. Ship House, Jodhpur, Rajasthan- 342 006 to repay the amount mentioned in the notice being Rs. 1,41,73,047.40 (Rupees One Crore fourty one lakhs seventy three thousand fourty seven and paisa fourty only) as on 06,04.2018 with further interest and costs within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to borrower and the public general that the undersigned has taken **physical possession** of the property described herein below in exercise of powers conferred on him under sub section (4) of section 13 of Act read with rule 8 of the security interest (Enforcement) Rules, 2002 on this the 04th day of November of the

The borrowers in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of The South Indian Bank Ltd. for an amount of Rs.1,84,93,250.02 (Rupees One Crore Eighty Four Lakhs Ninety Three Thousand Two Hundred Fifty and Paisa Two only) as on 28.02.2020 and interest and costs

The borrower's attention is invited to provisions of sub section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE PROPERTIES

All that Commercial property situated at Shop No.17 admeasuring about 319.00 sq.fts., equivalent to 29.63 sq.mts, super built up area together with undivided proportionate share underneath land admeasuring about 3.30 sq.mts. on Ground Floor of Commercial Building of "Afil Tower", constructed on the land bearing Rev Sy. No.32/2 T.P. Scheme No.8{Umarwada}F.P.No.10 of village:Navagam, Surat, City Surat Taluka:Choryasi, Dist: Surat owned by Mr. Amit Shantial Chopra more fully described in Sale Deed No.21846/2010 dated 31.12.2010 of Surat SRO and bounded by -

North by - Stair, South by - Adjoining Property East by - Passage, West by - Shop No.18

All that Commercial property situated at Shop No.18 admeasuring about 339.00 sq.fts, equivalent to 31.49 sq.mts, super built up area together with undivided proportionate share underneath land admeasuring about 3.51 sq.mts. on Ground Floor of Commercial Building of "Afil Tower", constructed on the land bearing Ny. No.32/2 T.P. Scheme No.8(Umarwada)F.P.No.10 of village:Navagam, Surat, City Surat Taluka:Choryasi, Dist: Surat owned by Mr. Amit Shantilal Chopra more fully described in Sale Deed No.21848/2010 dated 31.12.2010 of Surat SRO and bounded by a SRO and bounded by -

North by - Shop No.19, South by - Shop No.17 East by - Passage, West by - Adjoining Property

All that Commercial property situated at Shop No.19 admeasuring about 286.00 sq.fts, equivalent to 26.57 sq.mts, super built up area together with undivided proportionate share underneath land admeasuring about 2.96 sq.mts. on Ground Floor of Commercial Building of "Afil Tower", constructed on the land bearing Rev. Sy. No.32/2 T.P. Scheme No.8(Umarwada)F.P.No.10 of village: Navagam, Surat, City Surat Taluka:Choryasi, Dist: Surat owned by Mr. Amit Shantilal Chopra more fully described in Sale Deed No.21850/2010 dated 31.12.2010 of Surat SRO and hounded by -SRO and bounded by -

North by - Shop No.20, South by - Shop No.18 East by - Passage, West by - Adjoining Property

Date : 04.11.2020 Place : Surat

Authorised Officer The South Indian Bank Ltd.

નોટબંધીએ અર્થવ્યવસ્થાને બરબાદ કરી : રાહુલ ગાંધી

નવી દિલ્હી,તા. 2. કોંગ્રેસ નેતા રાહુલ ગાંપીએ નોટબંધી મુદ્દે કેન્દ્ર સરકારની આલોચના કરતા રવિવારે આરોપ લગાવ્યો કે ચાર વર્ષ પહેલા પ્રધાનમંત્રી નેત્રન્ત્ર મોદીનો ઉદ્દેશ્ય પોતાના કેટલાક ઉદ્યોગપાંતિ જ્યોની મદદ કરવાનો હતો અને તેશે ભારતીય અર્થવ્યવસ્થાને ભરબાદ કરી દીધી. ગાંધી અને કોંગ્રેસ આરોપ લગાવતા રહ્યાં છે કે ૨૦૧૬ મા કરવામાં આવેલી નોટબંધી લોકેના હિતમાં નહતી અને તેનાથી અર્થવ્યવસ્થા પર વિપરીત અસર પડી છે. આ આરોપને સરકારે વારંવાર નકામાં છે. નોટબંધીના વિરાયમાં પાર્ટીના ઓન્લાઇન અભિપાન સ્પીક અપ અર્ગેસ્ટ ડિમો ડિઝાસ્ટર દેકળ જારી એક વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, સવાલ તે છે કે ભાંગદાદેશની અર્થવ્યવસ્થા પૂર્વ જો લીતે ભારતની અર્થવ્યવસ્થા આગળ વર્ષા ગઈ. કારણ કે એક સમય હતો જ્યારે ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી ઇચ્ચ પ્રદર્શન કરનારી અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી ઇચ્ચ પ્રદર્શન કરનારી અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી ઇચ્ચ પ્રદર્શન કરનારી કહે છે કેનાં કારણ કરીલડ છે. પરંતુ જો આ કારણ હોય તો કીવિડ બાંગ્લાદેશ અને વિશ્વમાં અન્ય જગ્યાએ પણ છે. કારણ કીવિડ નાંથી, નોટબંધી અને જીએસર્ટી કારણ છે. નથી, નોટબંધી અને જીએસટી કારણ છે.



અમેરિકામાં રાષ્ટ્રપતિની ચુંટણીમાં જોય બિડેન અને ઉપરાષ્ટ્રપતિ તરીકે ભારતીય માતૃપક્ષ ધરાવતી કમલા હેરિસનો વિજય થતાં તામિલનાડુંમાં કમલા હેરિસના મોસાળના ગામ થુલાસેન્દ્રાપુરમ ગામના લોકો ટેડિશ્નલ કોલામ રંગકામ કલા મારફતે જમીન પર અભિનંદન . આપતું લખાણ ચિત્ર તૈયાર કરી રહયા છે.

આવતા વર્ષે ત્રણ રાજ્યમાં સફાયો કરાશે

હવે નક્સલીઓનો ગાળિયો કસવા અમિત શાહ તૈયાર

નવા દિલ્હા, તા. ૮ | તેમલ દળાની જાણકોરી યાગી છે, જ દેશના અગત્યના રાજ્યમાં નક્સલાદાદી નો નક્સલાદીઓના ઠેકાશાઓને ખતમ નથી કરી સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગૃહ મંત્રી અચિત શાહ ઘણા સક્રિય જોવા મળી રહ્યા છે. અધિકારીએ આપી છે. ગૃહ મંત્રીની સમીશા નક્સલવાદની વિરુદ્ધ ચાલી રહેલા મીટિંગમાં સેન્ટ્રલ પેરા પિલિટ્રી દળ, તેન્ટ્રલ અબિયાનથી અચિત શાહ નાખુશ છે. ગત આઈબી અને પાંચ રાજ્યોના સરકારી અધિકારી મહિને મળેલી મીટિંગમાં અધિકારીઓ પાસેથી

૩ રાજ્યમાં માઓવાદીઓના ઠેકાણાને ખતમ કરવાનું લક્ષ્ય

નક્સલવાદની સમસ્યાના ભ્યુરોએ ર નવેષ્બરેએક નિવેદન મદદ કરી શકાય ઉકેલ માટે ગત મહિને એક જાહેર કર્યું હતું. આ નિવેદનમાં પ્રકારના મુદ્દાઓ પર મીટિંગ મળી હતી. આ દાવો કરવામાં આવ્યો હતો કે અધિકારીઓએ જા મીટિંગનો મુખ્ય ઉદેશ્ય એ છત્તીસગઢમાં નવેષ્બર સૌથી વધુ ધ્યાન જ જાજ્ઞવાનો હતો કે જ્યાં, ક્યારે ૨૦૨૦થી જૂન ૨૦૨૧ની વચ્ચે યાદીમાં હજુ પણ છ અને કેમ પરેશાની આવી રહી પ્રહાર-૩ નામથી એક નામ સૌથી પહેલા છે. છે. ગોપનીયતાની શરત પર અક તાંઆરમાં અમા ત્યાપવાના આપા હાઇ છે. જોક અધિકારીએ મ્યુઝર દને જશાવ્યું સલાહકાર વિજય હુમારે કે બિહાર, ઝારખંડ અને ઓપરેશન કે તેનો સમય મહારાષ્ટ્રમાં આગામી ઉનાળા જણાવવાનો ઇકાર કરી દીધો માઓવાદીઓના હતો મુજબૂત ઠેકાશાઓને ખતમ કરવાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ પ્રકારના દાવા સીપીઆઇ માઓવાદીના સાઉથ સબ ઝોનલ બ્યૂરોએ પણ કર્યા હતા.

अभित અધ્યક્ષતાવાળી સમીક્ષા મીટિંગ બાદ તરત જ સીપીઆઇ

રિસાના જોવા રહા પ્રહાર-ઉ નાનવા અંક પાનસાવા રહ્યા છે. છે છે છે. ત્રિયતાની શરત પર ઓપરેશનની યોજના મળેલી મીટિંગના તરત બાદ જ સીઆરપીએફના બનાવવામાં આવી રહી છે. જોકે વિજયકુમાર બસ્તરની સ્થિતિની

જોકે, ગૃહ મંત્રીએ રાજ્ય અને કેન્દ્રના દળોને પરસ્પર સારી રીતે કામ કરવા માટે કહ્યું છે. તેઓએ જણાવ્યું કે, ગૃહ મંત્રીએ એવા રાજ્યોની મદદ કરવા માટે સમીક્ષા કરી છે, જે શાહની સારું પ્રદર્શન નથી કરી શકતા. તેઓએ જજ્ઞાવ્યું કે, કયા રાજ્ય પૂરતું કામ નથી કરી રહ્યા, રાજ્યોની ભવિષ્યમાં કેવી રીતે

અધિકારીઓએ જણાવ્યું કે, **સૌથી વધુ ધ્યાન આપનારી** યાદીમાં હજુ પણ છત્તીસગઢનું નામ સૌથી પહેલા છે. દિલ્હીમાં પોલીસ અધિકારીઓને મળવા સુકમા માટે રવાના થયા હતા. વાપસી પર તેઓએ ન્યૂઝ૧૮ને જણાવ્યું કે, છત્તીસગઢમાં નક્સલ સેનામાં સ્થાનિક લોકોને સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યા તેઓએ જણાવ્યું કે ઇન્ટેલિજન્સે રવ્રનીતિઓ જજ્ઞાવી છે. આ ઉપરાંત ગૃહ મંત્રીએ રાજ્ય અને કેન્દ્રની પોલીસની વચ્ચે સારા તાલમેલ ઊભો કરવા માટે કહ્યું

પ્રકારના મુદ્દાઓ પર ચર્ચા થઈ.

નોટબંધીને ચાર વર્ષ પુરા

એનએસયુઆઇ કાર્યકરોએ આરબીઆઇ કચેરી બહાર પ્રદર્શન, સુત્રોચ્ચાર કર્યા

(હિ.મી.એ), નવીદિલ્હી,તા.૮ નોટબંધીને આજે ચાર વર્ષનો સમય વીતી ગયો છે આ પ્રસંગ પર એનએસયુઆઇના રોકવા માટે ભારે પોલીસ દળ તહેનાત કરવામાં કાર્યકરોએ અર્થવ્યવસ્થાની અર્થી કાઢી નોટબંધીની વિરૂધ્ધ પ્રદર્શન કર્યા આ દરમીયાન અનેક કાર્યકરોને હિરાસતમાં લીધા છે.

નોટબંધી વડાપ્રધાનની સમજેલી વિચારેલી ચાલ હતી

પ્રદર્શન પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ કુંદનના નેતૃત્વમાં કર્યું કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પૈજ઼ ટ્વીટ કરી નોટબંધીના નિર્ણય પર મોદી સરકારની ટીકા કરી હતી રાહુલ આવી હતી આ રાષ્ટ્રીય ગાંધીએ ટવીટ કરી લખ્યું કે ત્રાસદીના ચાર વર્ષ તમને પણ નોટબંધી વડાપ્રધાનની સમજેલી પોતાનો અવાજ બુલંદ

રૂપિયાની લોન માફ કરી શકે રાહુલ ગાંધીએ કહ્યું કે

ગલતફેમીમાં રહેશો નહીં ભલ નથી થઇ જાણી જોઇને કરવામાં



આત્મહત્યા કરવામાં દ્રષ્ટોરણાના કેસમાં ધરપકડ કરાયેલા રિપબ્લિક ીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીને મુંબઇમાં અલિબાગથી ાવી મુંબઇ તલોની સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવી રહયા હોવાર્થ ાલોની જેલ બહાર પોલીસ તૈનાત કરવામાં આવેલા છે.

એ નાએ સાયુ આ ઇએ વિચારેલી ચાલ હતી જેથી કરો.પોતાના આ ટ્વીટની સાથે નોટબંધીની વિરૂધ્ધ આ વિરોધ જનતાના પૈસાથી મોદી મિત્ર રાહુલ ગાંધીએ પોતાની એક મુડીપતિઓને લાખો કરોડ વીડિયો પશ શેરકરી જેમાં તેમણે દેશની ઘટતી અર્થવ્યવસ્થાના મુદ્દા પર મોદી સરકારની ટીકા કરી અને કહ્યું કે નોટબંધી અને જીએસટીના નિર્ણયને કારણે અર્થવ્યવસ્થાને નુકસાન થયું છે. રાહુલ ગાંધીએ આરોપ

લગાવ્યો કે નોટબંધીના સમયે લગાવ્યા *ક* નાટબવાના સમય વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ કાળા નાણાંની વિરૂધ્ધ લડાઇ

પરંતુ આ કાળાનાણાંની વિરૂધ્ધ લડાઇ ન હતી આ ખોટું હતું મોદીએ તમારા પૈસા તમારી પાસેથી છીનવી પોતાના ગણતરીના ઉદ્યોગપતિ દોસ્તોને આપવા માંગતા હતાં ત્યારબાદ મોદીએ ખોટી રીતે જીએસટી લાગુ કરી જેથી નાના દુકાનદારો નાના અને મીડિલ સાઇઝ વિઝનેસ વાળાને ખતમ કરી દીધા અને પોતાના પસંદગીના ત્રણ ચાર ઉદ્યોગપતિ મિત્રો માટે રસ્તો સ્પષ્ટ કર્યો.

હિમાલયની પહાડીઓ મોરારીબાપુની ૮૫૦મી રામકથા યોજાઈ

હિયાલયની ગોદમાં આવેલા રમક્ષીય પ્રાકૃતિક અને આધ્યાસ્થિક કર્જા ધરાવતા ઉત્તરાખંડના વિશ્વપ્રક્ષિક પર્યટન સ્થળ મસુરીમાં ગિરીકંદરાઓમાં તજગાજરહી વ્યાસપીઠ ઉપરથી પૂજ્ય મોરારી બાપુની પપ૦મી રાયકથા ચાલી રહી છે. કોરોના સંદર્ભ કેન્દ્ર સરકાર અને ઉત્તરાખંડ રાજ્ય સરકારના દિશા-નિર્દેશોનું પાલન કરતાં સિમિત સંખ્યામાં શ્રોતાઓને રામકથામાં સામેલ થવાની અનુમતિ છે. જોકે, જે શ્રોતાઓ પ્રત્યક્ષ રીતે કથાનો લાભ લઇ શક્યાં નથી. તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી રામકથાની લ્હાવો લઇ રહ્યાં છે.

મીત્રિયાના માધ્યમથી રામકથાનો હહાવો લઇ રહ્યાં છે. 3૧ ઓક્ટોગલેર શરૂ થયેલી કથાના પ્રારંભે બાયુએ જણાવ્યું હતું કે, આજની રાત અમૃતપૃર્ણિમા કહેવાય છે અને ભૂગોળ પણ કહે છે કે, આજની રાતનો વેંદ્ર રસનો વરસાદ કરે છે. આજે કૃષ્ણએ રાસની રાત પસંદ કરી હતી. તેમણે કથાનો વિષય માનસ વાલ્મિકીય રાખવાનો વિચાર કર્યો. વાલ્મિકીન કર્યા, પરંતુ વાલ્મિકીય. આહે ભ સ્વાનપ્રયો વાલ્મિકીય રામાયણ અને તુલસીજી કૃત રામચરિત માનસનો તુલનાત્મક અભ્યાસ તો નહિ, પશ્ચ તુલનાત્મક દર્શન કરીશું. આ દરમિયાન તેમણે જણાવ્યં હતે કે.

જાવ્યાત તો પાક, પશ્ચ તુવારાત કરાય કરાયું. આ કરાયવાને તેનક જશ્ચાર્યું હતું કે, વાલ્પિકી અથવા વાલ્પિક શબ્દ રામચરિત માનસમાં સાત વખત હચ્ચારિત થયો છે. વાલ્પિકીય રામપણ અને તુવસર્તિત પત્મચરિત માનસનું તાત્વિક, ચાર્તિક અને વાસ્તિવિક દર્શન કરાવતા બાપુએ ઉમેર્યું હતું કે, વાલ્પિકીએ પણ સાત જ કંડ હખ્યાં છે પણ ત્યાં હેકાર્કા નવી પણ સુદ્ધકંડ નામ છે. તુલનાત્યક દર્શન કરાવતા બાપુએ જણાવ્યું હતું યજ્ઞ યુદ્ધકાંડ નામ છે. તુલનાત્મક દર્શન કરાવતા બાપુએ જજ્ઞાવ્યું હ્યુ કે, રામચરિત માનસમાં સંક્ષિપ્ત આખા રામાયશની સાર અંતે છે વાલ્મિકીયમાં એ પ્રથમ છે.

કોરોનાના કારણે દેશના ૧૨ ટકા સિનેમાઘર બંધ થવાને આરે

તકલીફ સ્ટુડિયોઝે

વધારવાનું શરૂ કરી દીધ છે. તે

અનેક ફિલ્મો હવે ઓટીટી પર

રિલિજ કરી રહ્યાં છે સ્ટીમિંગ

પ્લેટફોર્મનફો વધારવામાં

આવી રહ્યો છે સિનેમા ઘર

દેવાળીયા પર આવી ગઇ છે

આવનારાસમયે કંઇ પરિવર્તન

થાય તોવી આશા વ્યકત

કરવામાં આવી રહી છે.

Shiring street Str.

08878, 9427314771 ા કરાવનારે તેમની ઓફ્ટ બંધ વિબંધ કવરમાં **તા. ૧૯.૧૧.૨૦૨૦** કિલ્લા કવરમાં **તા. ૧૯.૧૧.૨૦૨૦**

(હિ.મી.એ),નવીદિલ્હી,તા.૮ કોરોના વાયરસને કારણે દેશની અર્થવ્યવસ્થાની ગાડી રિતારતી નજરે પડી રહી છે તમામ કામ ધંધા બંધ થઇ ચુકયા છે મોટી સંખ્યામાં મજદુરોનું પલાયન તમે લોકડાઉન બાદથી જોઇ ચુક્યા છે આ ઉપરાંત જો કોઇ ઇન્ડસ્ટ્રીઝને કોરોનાથી સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે તો તે છે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સતત અનેકમહીના સુધી શુટીંગ બંધ હોવાને કારણે ફિલ્મોની રીલીજ ડેટ આગળ ટાળી દેવામાં આવી રહી છે અનેક મોટા પ્રોજેક્ટ બંધ થઇ ગયા છે.હવે સિનેમાઘરોના અસ્તિત્વ પણ સંકટમાં નજરે પડી રહ્યું છે અનેક રાજયોમાં સિનેમાધર ખુલ્યા બાદ પણ આ દર્શકો માટે તરસી રહ્યાં છે તો કેટલાક સિનેમાધરોમાં જુની ફિલ્મો હોવાને કારણે કોઇ દર્શક નહીં આવતા તેને બંધ કરવા પડી રહ્યાં છે કારણ સિનેમાધરોના માલિકોને તેનો ખર્ચ પોષાય તેમ નથી

ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇડસ્ટ્રીઝ ફિક્કીના રિપોર્ટ અનુસાર લોકડાઉન દરમિયાન ૧૨ ટકા સિનેમાધર હંમેશા માટે બંધ થઇ ચુક્ય છે અનેક રાજયોમાં કોરોનાના કહેરને જોતા સિનેમાધર અત્યાર સુધી ખુલી શકયા નથી આવામાં અંદાજ લગાવી શકાય નહીં કે કેટલા વધુ સિનેમાધરો ફરી કયારે રોશન થશે

દેશમાં લગભગ ૧૦ હજાર સિનેમાઘર છે તેમાં સિંગલ સ્ક્રીન સિનેમાઘરોની સ્થિતિ લોકડાઉન બાદ સૌથી વધ ખરાબ થઇ છે.સતત બંધ રહેવાનો કારણે અહીં કામ કરનાર કર્મચારીઓનું પગારપ પણ આપી શકાતો નથી કોરોના કાળમાં સાવધાની દાખવવાને કારણે સિનોમાધરોમાં જવા ગભરાય છે આ સ્થિતિ ફકત ભારતમાં જ નહીં પરંતુ અમેરિકા સહિત અનેક મોટા દેશમાં પણ છે.

સિનો માઘર માલિકોની

ઓબામાએ જિલ બાઈડનને પણ શભેચ્છા પાઠવી

બરાક ઓબામાએ બિડેન અને કમલા હેરિસને શુભેચ્છા આપી વોશિંગ્સન, તા. ૮ પોતાનું કામકાશ સંભળિયો ત્યારે અમેરિકન માટે કામ કરશે.

જલ્મા રાષ્ટ્રપ્રમુખ બનવા જઈ રહેલા જો બાઈડનને શુભેચ્છા પાઠવી છે. સાથે–સાથે બરાક ઓબામાએ જો બાઈડનના પત્ની જિલ બાઈડનને પદ્મ શુભેચ્છા પાઠવી છે. બરાક ઓળામાએ અમેરિકાના આગામી વાઈસ પ્રેસિડેન્ટ તરીકે કમલા હેરિસને પજ્ઞ શુભેચ્છા પાઠવી છે. બરાક ઓબામાએ કહ્યું કે હું જો બાઈડન અને કમલા હેરિસને શુભેચ્છા પાઠવતા ગર્વનો અનુભવ કરી

રહ્યો દુર્વ. બરાક ઓબામાએ સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરતા કહ્યું કે આ વખતે ચૂંટણીમાં પહેલી વખત અમેરિકાના લોકોએ આટલી મોટી સંખ્યામાં મતદાન કર્યું છે. એકવખત જ્યારે તમામ મતોની ગણતરી થઈ જશે ત્યારે ચૂંટવામાં આવેલા **પ્રેસિડેન્ટ અને વાઈસ-પ્રેસિડેન્ટ** માટે આ ઐતિહાસિક જીત હશે

જો બાઈડનમાં તે તમામ ગુણ છે જે એક પ્રેસિડેન્ટમાં હોવા જોઈએ. આગામી વર્ષે યુઆરીમાં જ્યારે જો બાઈડન ઓફિશિયલી વ્હાઈટ હાઉસમાં

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રમાણ તૈયના સાથે મોટા પડકારો હશે. તેમણે કહ્યું કે – મને ખબર છે કે બરાક ઓબામાએ અમેરિકાના જેમાં કોરોના વાયરસની તેઓ દરેક અમેરિકનના હિતમાં મહામારી, અસમાન અર્થવ્યવસ્થા અને ન્યાયિક

બરાક ઓબામાએ આશા બાઈડનને તક આપે અને તેમનું વ્યક્ત કરી કે જો બાઈડન તમામ સમર્થન કરે.

અસમાન કામ કરશે, પછી તેમની પાસે કેન્યાયિક તેનો વોટ હોય કેના હોય. માટે વ્યવસ્થા, જળવાયુનો ખતરો હું તમામ અમેરિકનને તે માટે વગેરેનો સમાવેશ થાય છે. પ્રોત્સાહિત કરું છે કે તેઓ જો

પાંચ લાખ ભારતીયોને નાગરિકતા

આપી શકે છે નવા પ્રમુખ બિડેન નવી દિલ્હી: જો બાઇડને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ચૂંટશી માં ઐતિહાસિક જીત નીયાવી છે. તેઓએ એનાલ ટ્રમ્પને પછાડાર આપી છે. એવામાં એવી પશ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો બાઇડન અમેરિકામાં અપાવાસીઓની સમસ્યાઓનું પણ સમાયાન વાવત માટે યોખ પગલાં ભરી શકે છે. એવી પશ શક્યતા વ્યક્ત કરવામાં

માટે યોંગ્ય પગલાં ભરી શકે છે. એવી પણ શકતાં વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો લાઇકન ૧૧ લાખ બિન દસ્તાવેજી અપ્રવાસીઓને અમેરિકન નાવારીકતાનો રસ્તો પણ સરળ કરી શકે છે. તેમાંથી લાબભગ પ લાખ ભારતીય છે.
જો લાઇકને મુટલી અભિયાનના દસ્તાવેજમાં કહ્યું હતું કે, લાઇકન તરત જ કોંગ્રેસ (એમેટિકન મોસક)-ની સાથે ક્રમ કરવાનું શરૂ કરી કેશે, જેલી ઇંગ્રિગેશન સુધાર સંબંધી કાયદો પસાર કરી શકાય, જે આપણી પ્રકાશીને અસુનિક બનાવે છે, જેમાં લાગભગ ૧૧ લાખ બિન દસ્તાવેજ અપ્રવાસીઓ પાટે નાગરિકતા દોરોપ પ્રદાસ કરી રીતે પરિવારોને પ્રાથમિકતા પર રાખવામાં આવશે. તેમાં ભારતના પ લાખથી વધુ અપ્રવાસી સામેલ છે. એવામાં શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બાઇકન પરિવારોને પ્રાથમિકતા પર રાખવામાં આવશે. તેમાં ભારતના પ લાખથી વધુ અપ્રવાસી સામેલ છે. એવામાં શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બાઇકન પ્રકાશના પરિવાર આપારીને ઇંગ્રિયેશન પ્રકાશને સામે સ્ત્રે કે એને અમેરિકના ઇંગ્રીયેશન પ્રકાશીના મૂળ સિહ્સતના રૂપમાં પરિવારના એકીકાલ્સન સંરયિત કરશે. તેમાં પરિવાર વીઝા બેકલીગને ઓછો કરવો પણ સામેલ છે.

GUJARAT TERCE LABORATORIES LIMITED

122/2, Ravi Estate, Bileshwarpura, Chhatral, Dist. Gandhinagar (Gujarat)
Phone:-079 - 48333708, CIN NO: L24100GJ985PLC007763
email: gtll.factory@gmail.com website:www.gujaratterce.in

ncial Results for the Quarter and Half Year Ended on September 30, 2020

[RS.IN LAKHS EXCEPT PER SHARE DETAIL Half year ended 30.09.2020 30.09.2019 a) Revenue from operations (Net) b) Other income Net Profit / (Loss) for the period (before Tax, Excentional and/or Extraordinary items) -45.92 47.73 43.59 Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items) -45.92 47.73 43 59 (after Exceptional and/or Extraordinary Items)
Net Profit / (Loss) for the period after Tax
(after Exceptional and/or Extraordinary Items)
Total Comprehensive Income for the period
(Comprehensive Income for the period
(Comortising Profit (Loss) for the period (after tax)
and Other Comprehensive Income (after tax)
Paid up Equity Sharer Capital
Reserves (acciding Revaluation Reserve)
Net worth
Debt Equity Ratio 45.92 47.73 27.61 47.73 742.03 389.19 1,131.22 9 Debt Equity Ratio
10 Earnings Per Share (of Rs.10/-each)
(for continuing and discontinued operations)-

Date: 07.11.2020

Ganara Bank (૧) શેર્વોલેટ બીટ, DSL 1.0 Ls, જનસ્વ મોટર્સ, ૨૦૧૫ મોડલ, ડીઝલ.

Notes:

[1] The Roove unaudited results have been reviewed by Audit Committee and approved by the Board of Directors of the Company in their meeting held on 07.11.2002. The Statutory Auditors have carried out limited review of the financial results for the operation and operation and properties. 2021

[2] The Above unaudited results have been prepared and presented as per Companies (Indian Accounting Standards) Fules

2015 as amended ("IndiAP") prescribed under section 135 of the Companies Act, 2013 and in terms of Regulations of the SEBI (Listing Chiligations and Disciosure Requirements). Regulations, 2015 (the "Latting Regulations"), and amendmental mends berounded.

amendmenta made thereunder.

[3] The above is an extract of the detailed format of Financial Results for the quarter ended on September 30, 2020 filed with the Stock extendinges as per SEBI (Listing Obligations and Disclosure Requirement) Regulations, 2016. The full format of Consolidated financial results are available on the website of SSE at www.besindia.com and on company's website www.gujuttorsch.

By and order of the Board of Director For Gujarat Terce Laboratories Limited Sd/-

Aalan Prajanati Whole Time Director DIN: 08088327

SAYAJI

SAYAJI INDUSTRIES LIMITED

P.O. Kathwada – Maize Products, Ahmedabad – 382430 Website: www.sayajigroup.in • CIN: L99999GJ1941PLC000471

EXTRACT OF STANDALONE AND CONSOLIDATED UNAUDITEDFINANCIAL RESULTS FOR THE QUARTER AND SIX MONTHS ENDED 30™SEPTEMBER, 2020											
(₹ in Lakhs)											
	Standalone Financial Results			Consolidated Financial Results							
Particulars	Quarter ended		Six months ended	Quarter ended S		Six months ended					
. 1 900000	30-09-2020 Unaudited	30-09-2019 Unaudited	30-09-2020 Unaudited	30-09-2020 Unaudited	30-09-2019 Unaudited	30-09-2020 Unaudited					
ncome from operations (net)	13,866.28	13,834.48	21,727.71	14,045.75	14,009.99	22,707.48					
rofit (loss) for the period e tax and exceptional items)	1,099.29	(526.57)	407.22	1102.28	(546.76)	419.18					
rofit (loss) for the period before tax exceptional items)	1,099.29	(526.57)	407.22	1102.28	(546.76)	419.18					
rofit (loss) for the period after tax exceptional items)	639.08	(353.66)	34.01	647.42	(372.82)	56.19					
comprehensive income for the Period [comprising for the period (after tax) and other comprehensive e (after tax)]	674.40	(387.17)	73.21	682.74	(406.33)	95.39					
ip equity share capital (Face value of Rs.5/- each)	316.00	316.00	316.00	316.00	316.00	316.00					
ves excluding revaluation Reserves	7,374.11 as at March 31, 2020		7,372.13 as at March 31, 2020								

The results have been reviewed by the Audit Committee of the Boa meeting held on November 5, 2020 and have been reviewed by the The above is an extract of the detailed format of financial results for

sayajigroup.in

For and onbehalf of Board of Directors Varun Priyam Mehta Executive Director Din: 00900734